NMDC Limited Khanj Bhavan, (10.5'5117A, Caldle Hilk, Walsh) Tank, Hydenbad-500028 SUNTERACTION DEPARTMENT

Tender Enquiry No: HO(Contracts)/NISP/Maint/Inst/763 Dated:2801.2021 NMDC Limited, A "NAVAR ATNA" Public Sector Company under Ministry of Steel, Govt. of India, invites online bids from experienced domestic bidders for Maintenance of Instrumentation Installation of RMHS, Cokeoven, By-product, Sinter Plant and respective auxiliaries for a period of 2 years for 3.0 MTPA Integrated Steel Plant at

Nagamar near Jagdalpur, Chhattisgam State.
The detailed NIT and Bid documents can be viewed and /or downloaded from NMDC website: http://www.nmdc.co.in Central Public Procurement portal http://www eprocure.gov.in/epublish/app & MSTC portal https://www.mstcecommerce.co.in /ep to ch ome/nm dc from 28.01.2021 to 10.02.2021.

For accessing the bid document from MSTC portal, bidders to visit MSTC website and searchTenderEvent No. NMDC/H0/103/20-21/ET/789.

The Bidders, on regular basis are required to visit the NMDC website / CPP Portal / MSTC website for corrigendum, if any, at a future date.

Forfurtherclarification, the following can be contacted:

Chief General Manager (Contracts), NMDC Limited, Hyderabad, Fax No.+91-040-23534746, Tel No.+91-040-23532800, email: steelcontracts@nmdc.co.in

Chief General Manager (Contract

APM TERMINALS Lifting Global Trade. Gujarat Pipavav Port Limited

Regd. Office: Pipavav Port, At Post Rampara-2 via Rajula Dist. Amreli Gujarat-365560

CIN: L63010GJ1992PLC018106 Tel: 02794 242400 Fax: 02794 242413 Website: www.pipavav.com Email: investorrelationinppv@apmterminals.com

Pursuant to Regulations 29 and 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a Meeting of the Board of Directors of Gujarat Pipavav Port Limited ('the Company') will be held on Thursday 11th February 2021, to consider inter-alia Un-audited Standalone and Consolidated financial results of the Company for the Quarter and Nine Months ended 31st December 2020.

The Notice is also available on the Company website www.pipavav.com and on website of the Stock Exchanges www.bseindia.com and www.nseindia.com

For Gujarat Pipavav Port Limited

HAILEYBURIA TEA

ESTATES LTD.

Regd. Office : 24/432, Marrar Road Willingdon Island, Cochin - 682 003 CN : 1.01132/L1.1923PLC000415 Phone : (0484) 2667653 E-mei : chinnerte-a@gmail.com Website: www.chinnartea.com

NOTICE

Notice is hereby given for the meeting of the Board of Directors of the Company, which will be held on Finday, 8th Fabruary, 2021 at 10.30 am through Zoom Vidao Conferency at the Registered Office of the Company at 24452, Marar Road, Willingdon Island, Kochi

682003, interalle to consider and to take on record of the Un-Audited Financial Results of the Company for the Quarter Ended on 31st December, 2020.

For HAILEYBURIA TEA ESTATES LTD

Place : Kochi Sdl-Ashok Kumar Dugar Date : 27.01.2021 Managing Director

Manish Agnihotri Company Secretary & Compliance Officer

Date: 27th January 2021 Place: Mumbai



Nippon Life India Asset Management Limited

(CIN-L65910MH1995PLC220793) Registered Office: 4th Floor, Tower A, Peninsula Business Park, Ganapatrao Kadam Marg, Lower Parel (W), Mumbai - 400 013.

(formerly known as Reliance Nippon Life Asset Management Limited)

Tel No. +91 22 6808 7000 • Fax No. +91 22 6808 7097 • mf.nipponindiaim.com NOTICE CUM ADDENDUM NO. 103

Change in Key Personnel and Investor Relations Officer:

Notice is hereby given that Mr. Bhalchandra Joshi, Chief – Service Delivery and Operations Excellence & Customer Care has resigned from the services of Nippon Life India Asset Management Limited ("NAM India") with effect from the close of business hours on January 29, 2021. Pursuant to this resignation, Mr. Joshi shall cease to be the Key Personnel and Investor Relations Officer of NAM India/ Nippon India Mutual Fund.

Investors are further requested to note that, Mr. Milind Nesarikar, Chief Risk Officer of NAM India shall be now designated as Chief Risk Officer & Chief Service Delivery and Operations Excellence and will act as designated Investor Relations Officer of NAM India/ Nippon India Mutual Fund w.e.f. January 30, 2021. Therefore investors are requested to address all related queries to Mr. Milind Nesarikar at the following address:

Mr. Milind Nesarikar

PSP

Nippon Life India Asset Management Limited 4th Floor, Tower A, Peninsula Business Park,

Ganapatrao Kadam Marg, Lower Parel (W), Mumbai - 400 013.

Tel No. +91 022 6808 7000; Fax No. +91 022 6808 7097 Email: Milind.Nesarikar@nipponindiaim.com

Investors are requested to take note of the above. This addendum forms an integral part of the relevant Scheme Information Document of schemes and Statement of Additional Information. All the other terms and conditions of the aforesaid documents read with the addenda issued from time to time will remain unchanged.

For NIPPON LIFE INDIA ASSET MANAGEMENT LIMITED (formerly known as Reliance Nippon Life Asset Management Limited)

(Asset Management Company for Nippon India Mutual Fund) Mumbai

Authorised Signatory January 27, 2021 Make even idle money work! Invest in Mutual Funds

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

PSP Projects Limited

CIN No.L45201GJ2008PLC054868

Registered Office: PSP House, Opp. Celesta Courtyard, Opp. Lane of Vikramnagar Colony, Iscon - Ambli Road, Ahmedabad - 380 058. Website: www.pspprojects.com Email: grievance@pspprojects.com

Extract of Statement of Unaudited Consolidated Financial Results for the (₹ in Lakhs) Quarter and Nine Months ended December 31, 2020

		Quarter	Engeg	Mille Mouths Fire
Sr. No.	Particular	31-12-2020 (Unaudited)	31-12-2019 (Unaudited)	31-12-2020 (Unaudited)
1.	Total Income from Operations Net Profit for the period (before Tax, Exceptional and Extraordinary Items and Share of Profit/(Loss) from Joint Venture)	39,390.67 3,923.41	42,849.54 4,827.19	75,315.96 5,565.08
3.	Net Profit for the period (after tax, Exceptional and Extraordinary Items before Share of Profit/(Loss) from Joint Venture)	2,855.06	3,626.12	4,129.33
4.	Net Profit for the period (after tax, Exceptional and Extraordinary Items and Share of Profit/1Loss) from Joint Venture)	2,870.66	3,647.52	3,921.05
5.	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	2,868.11	3,644.02	3,914.53
6.	Paid-up Equity Share Capital - Face Value Rs. 10/- each	3,600.00	3,600.00	3,600.00
7.	Other Equity excluding Revaluation Reserves			
8.	Earnings per Share of Rs. 10/- each (in Rs.) (not annualised)			0.00000
	Basic	8.11	10.15	11.05
	Diluted	8.11	10.15	11.05

The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meeting held on January 27, 2021.

The above is an extract of the detailed format of Financial Results for the Quarter and Nine Months ended December

2020 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements | Regulations, 2015. Additional information on Unaudited Standalone Financial Results is as follows:

	Standalone						
Particular	Quarter	Nine Months Ended					
	31-12-2020 (Unaudited)	31-12-2019 (Unaudited)	31-12-2020 (Unaudited)				
Revenue from Operations Profit before tax and Exceptional Item Profit before tax and after Exceptional Item Profit after tax	39,015.86 4,127.38 3,853.27 2,791.83	42,306.64 4,881.32 4,881.32 3,674.77	74,013.60 5,684.23 5,410.12 4,010.45				

Months ended December 31, 2020 are available on the website of BSE Limited (URL: www.bseindia.com) , National Stock Exchange of India Limited (URL: www.nseindia.com) and on company's website (URL www.pspprojects.com) Previous period figures have been regrouped/rearranged, wherever necessary, to correspond to current period's

For and on behalf of the board For, PSP Projects Limited Place: Ahmedabad

Date : January 27, 2021

Prahaladbhai S. Patel Chairman, Managing Director & CEO DIN No. 00037633

The Singareni Coilieries Company Limited (A Government Company)
Regd. Office: KOTHAGUDEM- 507101, Telangana. E-PROGUREMENT TENDER NOTICE published for the fol

ers have been published for the following Services / Material Procure through e-procurement platform. For details, please visit https://tender.telangana.gov.in - or - https://www.sccimines.com ITT/Enquiry No.- Description / Subject- Last date and time for Submission of bid(s

E172000345- Annual Maintenance Contract (AMC) of portable wireless sets handheld (KENWOOD make model TK 2317/TK 2170) for 3 years - 06.02.2021-E0720O0158- Procurement of 15,000 Jars of CO2 absorbent for use at Rescue

Service Points of SCCL - 06.02.2021-17:00 Hrs. E172000358- Renewal of UTM Firewall service support along with upgrade for 3 years w.e.f 13.04.2021 in respect of 4 areas - 06.02.2021-17:00 Hrs.

E052000351- Procurement of Pig item for CI casting at Foundry, Central workshop, Kothagustern-06.02.2021-17:00 Hrs. E072000352- Procurement of 18.00 X 25-32 PR Tyres E-4 TL WITH O-RING for a period of one year - 10.02.2021-17:00 Hrs.

E0720C0352-Procurement of 18.00 x 253 PR Tyres E-4 TL WITH 0-46NG for a period of ane year - 10.02 z 0021-17:00 Hrs.

E1420C0367- Excavation, loading, transportation and delivering of sand from Kudrurpalli Sand Cuarry (Goduvar Rivery to KTK.1,5 and 6 Inclines, Bhupatpalli Area for a period of 2 Years - 11.02 z 2021-10:30 Hrs.

E0420C0355- Procurement of Zero constant circular prisms of 2km and 5km on RC basis for two years period through Open enquiry - 11.02 z 2021-11:00 Hrs.

E0420C0355- Procurement of HDPE Pipes on RC basis for one year period through Tender-Cum-Reverse Auction-reg - 11.02 z 2021-17:00 Hrs. - GM (MP)

NIT No., Date - Name of the work - Estimated Contract Value - Last date & time for Submission of bids

CW/STPP/E-26/T-36/2020-21, Dt. 13.01.2021- "Miscellaneous civil works in main plant area (BTG) at 2x600 MW STPP, Jaipur (VSM), Mancherial district, Telangana State," - Rs. 3.2, 21, 8655-01.02.2021-4-30 P.M.

CW/STPP/E-28/T-36/2020-21, Dt. 13.01.2021- "Miscellaneous civil works in Ash Handling plant & Pre-Treatment area at 2x500 MW STPP, Jaipur (VSM), Mancherial district, Telangana State," - Rs. 3.4, 96, 633-01.02.2021-4-30 P.M.

CW/STPP/E-28/T-38/2020-21, Dt. 13.01.2021- "Miscellaneous civil works in Coal Handling plant area at 2x600 MW STPP, Jaipur (VSM), Mancherial district, Telangana State." - Rs. 3.4, 96, 633-01.02.2021-4-30 P.M.

CW/STPP/E-28/T-38/2020-21, Dt. 13.01.2021- "Miscellaneous civil works in Coal Handling plant area at 2x600 MW STPP, Jaipur (VSM), Mancherial district, Telangana State." - Rs. 3.4, 94-40 P.M.

-Dy.GM (Clivili) / Mc STPP (Civili) -Dy.GM (Civil) / No STPP (Civil)

CW/KGM/e-32/2020-21. Dt. 20.01.2021- M. & R. works for Section No 3K/B area, i.e., Quarters like Old-B (Tied/Terraca roof), NC, NB, MEC-B, BCH type, Stadium Ground and Sub-Station (Poet Office) etc., at Ganeshpuram area, Kothagudem Corporate for the Year 2020-21, Bhadradri Kothagudem District, Telangana State - Rs. 39,22,442/-05.02.2021-4:00 P.M. - GM (Civil) PR/2020-21/MP/CVL/81

Hero

Hero MotoCorp Limited

Regd. Office: The Grand Plaza, Plot No.2, Nelson Mandela R

Vasont Kurij - Phase-II, New Delhi - 119070

CIN: L359110L1984PLC017354 | Phono: 011-46044220

Fax: 011-46044399 | E-mail: secretarialho@heromotocorp.co

Website: www.heromotocorp.com

PUBLIC NOTICE FOR ISSUE OF DUPLICATE SHARE CERTIFICATES

embers of the general public and existing shareholders of Hero Motoccorp Ltd. Company') are hereby informed that the Original Share Certificates, details of which a given hereunder have been reported testimisplaced-stoten/hot received and that usuant to requests received from concerned shareholders, the Company intends to usua duplicate share certificates in ilou of the said Original Share Certificates (Face also Rs.2/-) in their favour: Folio No. Shareholders Face Distinctive Nos. Certificate No. of

	Name	Value		No.(s)	Shares
HML0084900	SIMANTI BAGCHI	Rs.25	47410401-47411270	513618	870
	531.003655	Rs.10-	4264916-4264965	86308	50
			12614727 -12614746	146285	20
			T6250042 -16260051	243091	10
			16260052 -16260056	243092	05
			16260057 -16260058	243093	02
			21081060-21081109	346248	-50
			21061110 -21061146	346249	37
HML0037600	SHRIKANT GIRDHARLAL SHAH	Rs.2/-	45044536 - 45044735	508801	200
HML0118071	S K KHOSLA	Rs.10	1389666 - 1389715	27803	50
HML0091102	KULWANT SINGH BAGGA DARSHAN SINGH BAGGA	Rs.10/-	18384174 -18384223	247962	50
HML0111337	ASHOKA KUMARI TUNUGUNTLA	Rs 21-	159371786-159371950	529163	65

Notice. In the meanwhile, members of the public are hereby cautioned against dealing in the above mentioned Share Certificates.

Necrja Sharma Company Secretary & Chief Compliance Officer Date : 27/01/2021

Union Bank to raise ₹205 crore by issuing bonds Union Bank of India on Wednesday said it will raise ₹205 crore by issuing Basel III compliant is January 29, 2021.

bonds later this week. The coupon is fixed at 8.73% per annum to be payable annually. The date of allotment of bonds

ARVIND LIMITED ACVIDD CIN-117119G/1931PLC000093

Tele .: +9179 68268000-8108-09 NOTICE

uant to Regulation 47(1)(a) of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that the meeting of the Board of Directors of the Company will be held on Thursday, February 04, 2021 at Ahmedabad to consider and approve, among other items, the Unaudited Financial Results (Standalone & Consolidated) of the Company for the quarter and nine months ended on December 31, 2020. The Notice of this meeting is also available on the Company's website

(www.arvind.com) and also on the Stock Exchanges' websites viz. National Stock Exchange of India Limited (www.nseindia.com) and BSE Limited

For Arvind Limited R. V. Bhimani Company Secretary

27.01.2021

NTPC Limited (A Govt. of India Enterprise)

CIN: L40101DL1975GOI007966

Regd. Office: NTPC Bhawan, SCOPE Complex, 7 Institutional Area, Lodi Road, New Delhi-110 003 Tel. No. 011-24360100, Fax: 011-24361018, E-mail: contpc@ntpc.co.in,

NOTICE OF BOARD MEETING AND FIXATION OF RECORD DATE NOTICE OF BOARD MEETING AND FIXATION OF RECORD DATE Pursuant to Regulation 28 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held at New Delini on Thurschay, February 4, 2021, to linear alla, consider, approve and take on record un-audited Financial Results of the Company for the quarter and nine-months period ended on December 31, 2020, after these results are reviewed by the Audit Committee of the Board, Interior dividend on the equity share capital of the Company for the year 2020-21 may also be, inter-alia, considered in the same Meeting of the Board of Directors.

Notice is further given that the Company has fixed Friday, February 12, 2021 as the "RECORD DATE" for the purpose of ascertaining the eligibility of the shareholders or payment of above interim dividend, if declared by the Board.

The interim Dividend, if disclared, shall be paid to those eligible members or their mandates whose names appear-

(a) as Beneficial Owners as at the close of business hours on Friday, February 12, 2021 as per the list of Beneficial Owners to be furnished by National Securities Depository Limited and Central Depository Services (India) Limited in respect of the phares held in Electronic Demotrom, and

as Members in the Register of Mambers of the Company after glving effect transactions in physical form fodged on or before Friday, February 12, 2021. Further, pursuant to the changes introduced w.e.f. April 1, 2020 by the Finance Act 2020, In relation to the taxetion of dividend, you may kindly refer to the communication uploaded for all the shareholders/prospective shareholders on NTPC website under the tab Investors<Dividend TDS Communication.

The said Notice and any other further information may be accessed on Company's website at www.ntpc.co.in and may also be accessed on the Si Exchanges website at www.bseindia.com and www.nseindia.com. Requests for transfer, communication for change of address. Bank details, and EGS details should be sent to the respective Depository Participants of the shareholders in case of dematerialised shares. The above details in respect of shares held in Physical

form should be sent to the Registrar and Transfer Agents of the Company at the following address: AlankitAssignments Limited, Unit: NTPC Limited

Alankit House, 4E/2, Jhandewalan Extension

Place: New Delhi

Members holding equity shares of the company in electronic mode, who have not registered their e-mail address, are requested to register their e-mail address through their Depository Participant (DPs) to enable us to send documents through electronic mode in future. Members who have registered their e-mail-ID are requested to keep it validated with their DP. mbers holding equity shares in physical form, who have not registered their

e-mail address, are requested to register their e-mail address with the Alenkii Assignments Limited, Registrar and Share Transfer Agent of the Company, to anable us to send documents through electronic mode in future. For NTPC Limited

> (Nandini Sarkar) Company Secretary

Leading the Power Sector

Duncan Engineering Limited

(Regd. Office : F-33, Rajangaon, MIDC, Tal. Shirur, Dist. Pune -412 209) (CIN NO.- L28991PN1961PLC139151)

Extract of Unaudited Financial Results for the Quarter & Nine Months ended December 31' 2020

		(R	s. in Lakhs)		s. in Lakhs		
Particulars	0	uarter Ende	d	Nine Mon	ths Ended	ed Year Ended	
· articular a	Dec 31, 2020	Sept 30, 2020	Dec 31, 2019	Dec 31, 2020	Dec 31, 2019	Mar 31, 2020	
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)	
1 Total Income from Operations	1,207.00	1,173.88	1,032.11	2,841.53	3,383.68	4,438.97	
2 Net Profit from ordinary activities after tax	112.65	164.76	80.33	199.37	406.77	326.30	
3 Total Comprehensive income for the period (Comprising profit for the period and Other Comprehensive Income for the period) after tax		166.71	77.65	197.65	398.53	318.03	
4 Equity share capital	369.60	369.60	369.60	369.60	369.60	369.60	
5 Reserve excluding Revaluation Reserve as per Balance sheet of previous accounting year	-	-	-		_	-	
6 Earnings per share (EPS) (Face value of Rs. 10/- each) Basic & Diluted	3.05	4.46	2.17	5.39	11.01	8.83	

The above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors in its meeting held on 28th January, 2020. The Auditor of the company have carried out Limited Review of the same.

The above is an extract of the detailed format of Quarterly and Nine Monthly Financial Results filed with the stock Exchanges under regulation 33 of the SEBI (Listing Obligation & Disclosure Requirements) Regulation, 2015. The full format of the Financial Results for the Quarter and Half Year ended Septemebr 30' 2018 are available on the Stock Exchange website, www.bseindia.com and Company's website www.duncanengg.com.

> By Order of the Board of Directors (Akshat Goenka)

> > **Managing Director**

Place : Noida Date: 27th January, 2021

Place: Digvijaygram Date: January 27, 2021

Shree Digvijay Cement Company Limited

Regd. Office: Digvijaygram 361140 (Gujarat)

Phone: 0288-2344272-75 Fax: 0288-2344092, Email: investors.sdccl@digvijaycement.com CIN: L26940GJ1944PLC000749, Website: www.digvijaycement.com

STATEMENT OF STANDALONE AND CONSOLIDATED RESULTS FOR QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2020

		(uarter ende	d		Nine	For the year ended		
Particulars	31/12/2020	30/09/2020	31/12/2020	30/09/2020	31/12/2019	31/12/2020	31/12/2020	31/12/2019	31/03/2020
	Consolidated		Standalone			Consolidated	Stand	dalone	Standalone
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	Audited
Total income from operations (net)	14,553.83	9,769.86	14,553.83	9,769.86	12,288.92	33,184.48	33,184.48	34,267.24	47,209.29
Profit / (loss) for the period	1,401.18	254.19	1,402.05	256.01	944.44	2,653.46	2,656.10	3,326.37	5,643.71
Total Comprehensive Income for the period	1,396.82	264.31	1,397.69	266.13	912.00	2,640.43	2,643.07	3,282.21	5,602.43
[Comprising Profit for the period (after tax) and									
other Comprehensive Income (after tax)]									
Equity Share Capital	14,211.62	14,189.23	14,211.62	14,189.23	14,137.50	14,211.62	14,211.62	14,137.50	14,137.50
Reserves (excluding Revaluation Reserve as shown									13,502.52
in the Balance Sheet of prevoius year)									
Earnings Per share (of Rs.10/- each) (not annualised)									
Basic earning per Share (In Rs.)	0.99	0.18	0.99	0.18	0.67	1.87	1.87	2.35	3.99
Diluted earning per Share (In Rs.)	0.96	0.17	0.96	0.18	0.67	1.81	1.81	2.35	3.96
The above is an extract of the detailed format of Standal the SEBI (Listing and Other Disclosure Requirements) Re							-		

available on the Stock Exchange websites at www.bseindia.com or www.nseindia.com or at Company's website at www.digvijay.cement.com

For Shree Digvijay Cement Company Limited

K. K. Rajeev Nambia **CEO & Managing Director** (DIN: 07313541)

Onion export yet to pick up pace despite lifting of ban

FE BUREAU Pune, January 27

ALMOST A MONTH after the Centre lifted the ban on onion exports, India has managed to export 40,000-50,000 tonne till date because of a lukewarm response from the international market, according to senior industry people. India exported onions

valued at \$198 million in the April-June period of FY21 and \$440 million through 2019-20. The country had exported around 10 lakh tonne in 2019-20. Bangladesh, Malaysia, the UAE and Sri Lanka are the top importers of Indian onions. The ban on onion export, imposed on September 14, was lifted on January 1.

Ajit Shah, president, Horticulture Produce Exporters Association, said demand is picking up slowly. "Onions from Pakistan are currently being sold at \$275 per tonne (freight on board) while Indian onions are costlier at \$450 per tonne (FOB). Therefore. there is not much movement happening," he said."Other countries are still in the process of completing consignments from Pakistan and other exporting nations such as Turkey and Egypt. Once these are completed, they should turn towards India. We expect exports topick up in the next 15-

Shah had earlier said India can export some 20 lakh tonne this season after the arrival of the new crop.

Wednesday, On wholesale onion prices at Lasalgaon averaged at ₹2,500 per quintal, with the maximum price being₹3,099 per quintal and the minimum at ₹900 per quintal. Total arrivals were in the range of 24,624 quintal on Monday.

Manoj Jain, an onion trader in Lasalgaon, said although exports have begun, it is yet to pick up. Traders are currently focused on the domestic market because prices are better and there is no parity in the international market.

SBI Card chief Tewari resigns; appointed MD at State Bank

SBI CARD ON Wednesday said its managing director and CEO Ashwini Kumar Tewari has resigned pursuant to his appointment as MD of State Bank of India.

"We wish to inform that Ashwini Kumar Tewari, managing director & CEO

(nominated by State Bank of India) of the company has tendered his resignation from directorship of the company with effect from the close of business hours of January 2020," SBI Card said in a regulatory

filing.

The resignation owing to his appointment as managing director of State Bank of India (SBI), it said. "He will also cease to the MD&CEO of the company from the said date," said the pure-play

Sd/card company promoted by SBI. PTI

financi<mark>alexp.epam</mark>.in

Any person having objections to issue of duplicate Share Certificates, as mentione herein above, may submit the same, in writing, with the Company marked to the Secretarial Department at its Registered Office or send an email at secretarialho@heremetecorp.com within 7 days from the date of publication of this For Hero MotoCorp Ltd Sdi

FINANCIAL EXPRESS

From the Front Page

Daiichi: **Explain Fortis** share sale: SC to lenders

JUSTICE LALIT CAME down heavily on Malvinder. "Around 3 crore shares have gone away from the kitty after various assurances were given to the HC in June 2017. Around 30.65 crore encumbered and unencumbered shares were intact before assurances were given in June 2017. You never told the HC to take control of the situation if banks were selling securities. You should have informed the court about this while giving assurances. This means shares were in your control only. There is also a finding of guilt in your favour," the bench told Malvinder.

The judges also told Malvinder it would give him 10 days to either deposit the entire money in court or bring back the shares. "Resultant transaction must be annulled and original situation should be restored. Either shares have to be given back or you put in the money equivalent to this amount in the court," Justice Lalit told Malvinderwhile asking him to furnish the documents showing he had informed the lending banks and financial institutions from time to time about various directions issued by the courts with regards to assets/shares of the promoters.

The directions were issued after Malvinder's senior counsel Kailash Vasudev alleged that Fortis Healthcare shares owned by him and his brother Shivinderwere not transferred by the brothers to IHH Berhad but was by the banks.

Japanese drugmaker Daiichi Sankyo, which is seeking enforcement of the ₹3,500crore Singapore arbitration award against the Singh brothers, had alleged the duo had disposed of their controlling stakes secretly in Fortis Group

to IHH Healthcare despite giving several written assurances to the HC that they would not alienate their unencumbered

The brothers had given five written assurances before the Delhi HC they would not dilute their shareholdings in the hospital chain. However, their shareholding in the company declined from above 70% to below 1% after Daiichi Sankvo took them to court for enforcement of the award.

New CEO: ArcelorMittal plans \$1-bn cost cuts

FOR THE YEAR ahead, new CEO Aditya Mittal told a conference call that customers were rebuilding steel inventories and end-user demand was recovering following summer lockdowns.

Germany's Thyssenkrupp

APM TERMINALS

on Wednesday raised its fullyear outlook for the first time in nearly four years, boosted by a recovery at its steel unit.

ArcelorMittal said it would resume dividend payments, of \$0.30 per share, and would return a further \$570 million to shareholders through a new share buyback programme in addition to a \$650 million buyback announced on Tues-

group's shares were down 0.5% at €19.12 by 0855 GMT, but have recovered strongly from mid-2020 when they

manufacturing, construction and automotive industries.

market.

Fourth-quarter core profit

almost doubled to \$1.73 bil-The first batch of such demands (with gross expenditure of ₹2,35,853 crore) was placed before Parliament in -REUTERS September 2020 before the government rolled out mainly Fresh demand: demand-side stimulus mea-

> The government is seeking approval for additional spending, as it was forced to offer relief packages in the wake of the pandemic despite a plunge in revenue collections. Conse-

quently, its fiscal deficit is expected to shoot up to as high as 9.5% of GDP, according to the revised estimate for FY21. To fund the deficit, the Centre was also forced to raise twice its gross market borrowing to a total of ₹12.8 lakh crore in FY21, up sharply from the bud-

geted ₹7.8 lakh crore. According to the revised estimate of FY21, total expen-diture will rise to ₹34.5 lakh crore, against the budgeted

₹30.4 lakh crore. Revenue receipts, meanwhile, is estimated to slip to just ₹15.6 lakh crore in FY21 from the budgeted ₹20.2 lakh crore.

Even though the nominal GDP is expected to reverse a contraction and expand at 14.4% in FY22, the indispensability of continued spending to spur growth has forced the Centre to keep the deficit target elevated at 6.8% for the next fiscal as well.



KALYANI FORGE LIMITED

CIN - L28910MH1979PLC020959 Regd. Office: Shangrila Gardens, "C" Wing, 1st Floor, Opp.Bund Garden, Pune - 411 001 TS 16949 & OS 9000 ACCREDITED COMPANY

UL Kalyani Forge Ltd ISO/TS: 10949 ; 2002

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULT FOR THE QUARTER AND PERIOD ENDED December 31, 2020 (Rs. In lakha)

Sr. Na.	Particulars	Quarter ending 31/12/2020 (Unaudited)	Corresponding Quarter ending 31/12/2019 (Unaudited)	For Period ending 31/12/2020 (Unaudited)
1	Total income from operations	5,677	3,468	11,528
2	Net Profit /(Loss) from the period before Tax:	174	(339)	(316)
3	Net Profit /(Loss) from the period after tax	257	(265)	(140)
4	Total Comprehensive income for the period (comprising Profit / (Loss) for the period (After Tax) and Other Comprehensive Income (After Tax)	(19)	(3)	(57)
5	Paid up Equity Share Capital (Face value Rs. 10/- per share)	363.90	363.90	363.90
б	Earning Per Share (Face value Rs. 10/- Per Share)			
	Basic	7.05	(7.29)	(3.85)
	Diluted	7.05	(7.29)	(3.85)

Notes: 1) The above results of Kalyani Forge Limited for the quarter and period ended December 31, 2020 have been reviewed by the Audit Committee at its meeting held on 11th February, 2021 and approved by the Board of Directors at its meeting held on 11th February, 2021. The Statutory Auditors have carried out a limited review of the same.

2) The above is an extract of the detailed format of quarterty Financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the Stock Exchange websites www.nseindla.com and www.bseindia.com and on the Company's website www.katayniforge.co.in

Place: Pune Date: 11" February, 2021 For KALYANI FORGE LIMITED ROHINI G KALYANI **Executive Chairperson**

MPDL LIMITED

dy Known as Monnel Project Developers Limited Regd. Office: Plot No. 216, Sector - C, Urla Industrial Complex, Raipur (Chhattisgarh)-493221 Tel. No. 011-29218542-46; Fax: 011-29218541; e-mail: isc_mpdi@monnetgroup.com website: www.monnetgroup.com; CIN: L70102CT2002PLC015040

			Stand	talone	-	(RS. II		ept per st olidated	hare data)	
SI. No.	Particulars				Nine Months Ended	0	luarter En	CODE IN CO.	Nine Worths Ended	
		31.12.2020	36.69.2020	31.12.2019	31,12,2026	31.12.2020	30.09.2020	31.12.2019	31.12.2020	
			Unau	dited			Una	udited	anne saintean à la fai	
	Total income from operations (net) Net Profit / 8.css) for the period (before Tax	53.06	91.60	461.14	158.01	53.06	91.60	461,14	158.01	
	Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or	(75.53)	(72.67)	62.98	(83,16)	(75.53)	(72.67)	62.98	(83.16)	
4	Extraordinary items) Net Profit / (Loss) for the period after tax after Exceptional and/or	(75.53)	(72.67)	62.98	(83.16)	(75.53)	(72.67)	62.98	(83.16)	
10	Extraordinary ferms) Total Comprehensive Income for the period (Comprehensive Profit / (Losa) for the period (after tax) and Other	(75.53)	(72.57)	12.98	(83.16)	(75.53)	(72.67)	62.98	(83.16)	
id.	Comprehensive Income (after tax)) Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited	(75.53)	(72.67)	62:58	(83.16)	(77.10)	(106.60)	(74.47)	(139.51)	
,	Balance Sheet of the previous year Equity share capital (Face Value of	-	8	-	4,519.29	- 23	-		4,787.94	
	Rs.10 ⁻ per each) Earnings Per Share (of Rs. 10 ⁻ each) for continuing and discontinued operations)	741.25	741.25	741.25	741.25	741,25	741.25	741.25	741.25	
	(a) Basic (b) Oiluted	(1.02) (1.02)	(0.98)	0.85 0.85	(1.12) (1.12)	(1.04)	(1.44) (1.44)	(1.00)	(1.88) (1.88)	

(b) Disted The above Unsudited Financial Results were reviewed by the Audit Commit

approved by the Board of Directions of the Company at their meeting held on 11th February 2021. The results for the quarter ended 31,12,2020 have been subject to a Limited Review by the suditors.

Figures for the quarter ended 31 December 2020 are the balancing figures between the Unaudited figures for the nine months ended 31 December 2020 and the published unaudited. figures for the six months ended 30 September 2020. The above is an extract of the detailed format of Quarterly. Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of

the SERI II sting Obligations and Disclosure Requiremental Regulations, 2015. The full format of the Quarterly Financial Results in on the Stock Exchanges website (www.bseindia.com) and Company website www.monnetgroup.com For MPDL LIMITED

Place: New Delhi Date: 11th February 2021

Place: Gandhinagar

Date: February 11, 2021

(Formerly Known as Monnet Proj Braham Dutt Bhardwaj

ig held on 11th February 2021 and the



[CIN: L64203GJ2010PLC061366] Registered Office: 28th Floor, GIFT Two Building, Block No. 56, Road-5C, Zone-5, GIFT CITY, Gandhinagar, Taluka & District - Gandhinagar - 382 355

Tel: +91 79 67772204; Fax: +91 79 67772205 Email: ir@ia.ooo; Website: www.ia.ooo NOTICE OF EXTRAORDINARY GENERAL MEETING OF THE COMPANY TO BE HELD

THROUGH VIDEO CONFERENCE (VC)/OTHER AUDIO-VISUAL MEANS (OAVM) NOTICE is hereby given that the Extraordinary General Meeting ("EGM") of the Members of Infibear

Avenues Limited ('the Company') will be held on Tuesday, March 9, 2021 at 10:00 a.m. IST through Video Conferencing (VC) / Other Audio Video Means (OAVM) to transact businesses as set out in the Notice of the EGM. The said EGM will be convened in compliance with the applicable provisions of the Companies Act, 2013

"the Act") and the Rules made thereunder; provisions of the Securities and Exchange Board of India ("SEBI" (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing regulations"), the provisions of General Circular No. 14/2020 dated April 8, 2020; General Circular No.17/2020 dated April 13, 2020; General Circular No. 20/2020 May 5, 2020 and General Circular No. 39/2020 dated December 31, 2020 issued by the MCA and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 and Circular No. SEBI/HO/ CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 issued by SEBI ("MCA and SEBI Circulars") in view of the continuing Covid-19 pandemic.

In accordance with the aforesaid Circulars, the Notice of EGM along with the explanatory statement pursuant to Section 102 of the Act will be sent only through electronic mode to all the members whose email addresses are registered with the Company/Depositories. The Notice of the EGM will also be available on the website of the Company at www.ia.ooo and at www.nsdl.co.in and on the website of the stock exchanges. Members can attend and participate in the EGM through VC/OAVM facility only. The instructions for joining the EGM will be provided in the Notice of the EGM. Participation of members through VC/QAVM will be reckoned for the purpose of quorum for the EGM as per section 103 of the Companies Act, 2013.

The Company is providing remote e-voting facility to all its Members to cast their votes on all resolutions set out in the Notice of the EGM. Additionally, the Company is providing the facility of voting through e-voting system during the EGM. Detailed procedure for remote e-voting/ e-voting will be provided in the Notice of

In case of a member whose e-mail address is not registered / updated with the Company / RTA / Depository Participant(s), please follow the following steps to register email address for obtaining EGM Notice of the Company and login details for e-voting:

- a) For members holding shares in Physical mode please provide necessary details like Folio No., Name of shareholder by email to ir@ia.ooo.
- b) Members holding shares in Demat mode can get their E-mail ID registered by contacting their respective

Depository Participant or by email to ir@ia.oog The Notice of the EGM of the Company will be sent to the shareholders holding shares as on cut-off date

for the dispatch in accordance with the applicable laws on their registered e-mail addresses in due course. For Infibeam Avenues Limited

WWW.FINANCIALEXPRESS.COM

Shyamal Trivedi Vice President & Company Secretary

lion, beating an average forecast of \$1.47 billion in a company poll of analysts.

day.
The Luxembourg-based

were below €10. ArcelorMittal also said the impact of the second wave of Covid-19 had so far been limited on its customers in the

Analysts at Jefferies said solid earnings and the new shareholder returns policy should be welcomed by the

ment of fertilisers, primarily to clear fertiliser subsidies, and ₹20,467 crore for the capital expenditure of the ministry of defence. Similarly, extra spending of ₹1,22,208 crore is for providing loans to state governments via a special window under back-to-back loans to them in lieu of the GST com-

FM seeks

House nod for

extra spending

of ₹6.3 lakh cr

DEMANDS also include

₹65,412 crore for the depart-

pensation shortfall and under

SUPPLEMENTARY

special assistance (as loan) to them for capital expenditure.

GUJARAT PIPAVAV PORT LIMITED Registered Office: Pipavav Port, At Post Rampara-2, Tal. Rajula, Dist. Amreli, Gujarat 365560.

CIN: L63010GJ1992PLC018106 Tel: 02794 242400 Fax: 02794 242413 Website: www.pipavav.com Email: investorrelationinppv@apmterminals.com STATEMENT OF STANDALONE UNAUDITED RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31 DECEMBER 2020

Particulars	3 months ended	Preceding 3 months ended	Corresponding 3 months ended in the previous year	figure for current		Year ended
	31/12/2020	30/09/2020	31/12/2019	31/12/2020	31/12/2019	31/03/2020 (Audited)
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	
Total Income from Operations (Net)	1,984.00	1,826.60	1,965.81	5,400.36	5,734.27	7,353.69
Net Profit/(Loss) from Ordinary activities after Tax	542.07	E10 F0	1 202 54	1 507 00	2 420 07	2.011.20
(after extraordinary items) Paid-up equity share capital (Face value Rs. 10 per share)	543.27 4.834.40	519.59 4,834.40	1,203.54 4,834.40	1,527.02 4,834.40	2,438.87 4,834.40	2,911.32 4,834.40
Other Equity as per the Balance Sheet of previous accounting year	1,001.10	4,001.10		4,004.10	-,001.10	16,014.08
Earnings per share (Before and after extraordinary items) (of Rs. 10 each) (not annualized)						
Basic:	1.12	1.08	2.49	3.17	5.06	6.05
Diluted:	1.12	1.08	2.49	3.17	5.06	6.05

STATEMENT OF CONSOLIDATED UNAUDITED RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31 DECEMBER 2020 (Amt in Rs Million

Particulars 3 months Preceding | Corresponding 3 Year to date Year to date figure months ended in figure for current 3 months for previous ended ended the previous year period ended on period sended on 30/09/2020 31/12/2019 31/12/2020 31/12/2019 31/03/2020 31/12/2020 (Unaudited) (Unaudited) (Audited) (Unaudited) (Unaudited) (Unaudited) Total Income from Operations (Net) 1,984.00 1.826.60 1.965.81 5,400.36 5,734.27 7,353.69 Net Profit/(Loss) from Ordinary activities after Tax (after extraordinary items) 587.50 491.99 1,340.07 1,561.06 2.646.86 3,181.25 Paid-up equity share capital (Face value Rs. 10 per share) 4.834.40 4.834.40 4.834.40 4.834.40 4.834.40 4.834.40 Other Equity as per the Balance Sheet of previous 18,048.19 Earnings per share (Before and after extraordinary items) (of Rs. 10 each) (not annualized) Basic 1.21 1.03 2:77 3.24 5.49 6.61 3.24 5.49 1.21 1.03

Note: The above is an extract of detailed format of Quarter end Financial results filed with Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarter end financial results is available on the stock exchange websites

(www.besindia.com and www.nseindia.com) and on the company's website, www.pipavav.com Place: Mumbai

For Gujarat Pipavav Port Limited

Jakob Friis Sorensen Managing Director

Date: 11" February 2021

Brooks LABORATORIES LIMITED

BROOKS LABORATORIES LIMITED

CIN No.: L24232HP2002PLC000267

Regd. Off.: Village Kishanpura, Nalagarh Road, Distt. Solan, Baddi (HP)-174101 Telefax No :+91 1795 236939, E-mail : Investors@brookslabs.net, Website: www.brookslabs.net

EXTRACTS OF STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER & NINE MONTHS ENDED 31ST DECEMBER, 2020

(t in lacs) Standalone Consolidated No. Particulars **Quarter Ended** Nine Months Year Ended **Quarter Ended** Nine Months 31.03.2020 Ended Ended 31,12,2020 30.09,2020 31,12,2020 (Audited) 31.12.2020 30.09.2020 31.12.2020 (Unaudited) (Unaudited) (Unaudited) (Unaudited) (Unaudited) (Unaudited) 2.096.32 2,976.71 2,096.32 2,976.71 6.330.77 Total income from operations (net) 6.330.77 7.009.48 2 Net Profit / (Loss) for the period from ordinary activities (Before Share of (311.72)(263.88)(1,351.37)(311.75)336.55 (263.91) Profit / (Loss) of Associate, tax, Exceptional and /or Extraordinary Items). 3 Net Profit / (Loss) for the period before tax (after Share of Profit / (Loss) (207.86) (311.72) 336.55 (263.88)(1,351.37)(255.50)336.55 of Associate, Exceptional and /or Extraordinary Items) Net Profit / (Loss) for the period after tax (after Share of Profit / (Loss) of (311.72)336.55 (263.88)(2,437.60) (255.50)336.55 (207.66)Associate, Exceptional and /or Extraordinary items) 5 (314.43) (272.00) (258.21) Total Comprehensive Income for the period [(comprising profit or (loss) 333.59 333.59 (215.78)(2.422.87)for the period (after tax) and other Comprehensive income (after tax)] Equity Share Capital(Face Value ₹ 10/- per share) 2,470.28 2,470.28 2,470.28 2,470.28 2,470.28 2,470.28 2,470.28 Earnings per share (Before exceptional items) (of ₹ 10/- each) (not annualised) (a) Basic (1.27)1.35 (1.07)(13.84)(1.03) 1.35 (0.84)(b) Difuted (1.27)1.35 (1.07)(13.84)(1.03)1.35 (0.84)Earnings per share (After exceptional items) (of ₹10/- each) 8 (not annualised) (a) Basic (1.27)1.35 $\{1.07\}$ (13.84)(1.03)1.35 (0.84)(b) Diluted 1.35 (1.27)(13.84)(1.03)1.35 (0.84)(1.07)

FRIDAY, FEBRUARY 12, 2021

1 The above is an extract of the detailed format of Standalone and Consolidated Financial Results for the quarter 31st December, 2020 filed with the stock exhanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full format of the Standalone and Consolidated Financial Result for the quarter ended 31st December, 2020 is available on www.bseindla.com and www.brookslabs.net.

- 2 The above unaudited financial results of the Company for the quarter 31st December, 2020 have been reviewed by the Audit Committee and taken on record approved by the Board of Directors at its meeting held on 11th February, 2021. 3 The financial results for the quarter 31st December, 2020 have been reviewed by the Statutory Auditors as required under Regulation 33 of the SEBI (Listing Obligations and
- Disclosure Requirements) Regulations, 2015 as amended 4 The financial results have been prepared in accordance with the Companies (Indian Accounting Standard) Rules, 2015 as amended (Ind AS) prescribed under section 133 of the
- Companies Act, 2013 and other recognized accounting practices and policies to the extent applicable.
- 5 The Company has invested in Subsidiary and Associate during the quarter ended 30th September, 2020, hence the comparative figures of quarter of previous year / nise months ended are not available for consolidation

6 Comparative financial information of the previous quarter have been regrouped / rearranged wherever considered necessary to correspond to the figures of current quarter. For and on behalf of the Board Rajesh Mahajar Din: 02000634

Place: Mumbai Date: 11th February, 2021 Managing Director financial ep-



દામનગર ખાતે ઉત્સાહભેર

સુરતમાં ''પાસ'' દ્વારા ત્રિવિધ પ્રજાસત્તાક પર્વની ઉજવણી

માંગને લઇને તિરંગાચાત્રા ચોજાઇ

क्षेत्र क्षारची पद्य व्यक्तितली सरकायत

અમરેલીનાં મુખ્ય જિલ્લા આરોગ્ય

અધિકારીને શુભેચ્છા પાઠવવામાં આવી



લીલીયા ખાતે ભારત માતા અને વિવેકાનંદ જાની प्रतिमा प्रस्थापित करवामां आवी

argai min'u siyo mejard sinil, acrisi

વીજપડીના આહીર સમાજના કદાવર આગેવાન અશોકભાઇ લાડમોરે કેસરીયો ધારણ કર્યો

APM TERMINALS

મુજરાત વિચાનાન પોર્ટ શિચિટેડ

બાબરામાં તાલુકા પંચાયત કચેરીમાં હરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી



આગ લાગતા અકડાતકડી મર્ચો

અમરેલીમાં કોરોના વોરિચર્સને વેક્સિનથી રક્ષીત કરાચાં

તેક સ્વરાજ્યની સંદર્શ પછી પ

રાવની પરીસા લેવાની વિસારભ







બગસરા નગરપાલિકાનાં ચંટણી જંગમાં વોર્ડ નં. ૫ માં ઉકળતો ચરૂ भागपते शुक्रपुष्ट्राय प सुर्वत्व कारतीः कार्यव सप्तवीय व

રાજલામાં નગરપાલિકાનાં પર્વ પ્રમખશ્રી કિશોરભાઇ ધાખડા પરિવારમાં લગ્નોત્સવ

कांत्रप्रदेश तथा विशोध अस्य चामका पश्चित्रप्रसं असेशे साल

પુણ્યતિથિપર સંકલ્પ કાર્યક્રમ યોજાયો

આજથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

ચંટણીનાં પ્રચાર-પ્રસારનો શુભારંભ કરાવશે nouse the addition bissums a bus success

सहार समानी विद्यां भागमध्य सहये

MORRIS CHIES VIRGINI

જાકરાબાદનાં ખાલસા કંચારીયા બેઠક ઉપર શ્રી અનિરક્શભાઇ વાળા ભાજપના ઉમેદવાર माञ्चादाह ताकुश पंचायतमी तमाम द्वेडवर्ग भागप

રાજકોટનાં ચોરડા વિસ્તારમાં સાળાએ બનેવીની હત્યા હરી

die et up the -

die of EC. 11. 1000

non-fin struck